



'(लघु) अर्हनीति' मां प्रायश्चित्त विचार

डॉ. सुरेखा के. पटेल

संस्कृत विभाग

जी.डी.मोदी आर्ट्स कॉलेज पालनपुर

आचार्यश्रीनी वैविध्यपूर्ण अने विसमयज्ञनक काव्यसृष्टिमां तेमनी कुशाग्र कलमे कोईपणा विषय खोडाया विनानो रहो नथी. तेमनी सर्वग्राही बुद्धिशक्ति व्याकरण, छंद, अलंकार, कोश, पुराण, साहित्य, इतिहास, योग, स्तुति, स्तोत्र अने प्रमाणशास्त्र आदि विविध विषयोमां फरी वणी छे, जे तेमना विविध साहित्य सर्जन द्वारा विद्वित थाय ज छे. आचार्य हेमचन्द्रज्ञाने लगभग २,०४,६५९ श्लोकोनुं सर्जन करीने पाटणा नगरीने-गूर्जर भूमिने ज्ञान संस्करणाथी समृद्ध करी छे. एक जनश्रुति अनुसार आचार्यश्रीनी साडात्रणा करोड श्लोकोनी रचना करी छे जे कोईपणा ग्रंथकर्ता माटे विश्व विक्रम कही शकाय. सोकेटीस, एरिस्टोटल, प्लेटो के कन्फ्युसीयस जेवा महान ज्ञानीओनी होणमां मूळी शकाय तेवा आचार्यश्रीनुं स्थान दुनियाना साहित्यकारोमां अद्वितीय छे.

समग्र भारतीय साहित्यज्ञगतमां अत्यंत पूजनीय अवो 'कलिकालसर्वज्ञ' तरीके सुप्रसिद्धि धरावनार अजोड साहित्य-सूचा, अनुपम युगदण्डा, कुशण राजनीतिज्ञ अने सर्वतोमुखी परिषितप्रश्ना धरावता आचार्यश्रीना पूर्वज्ञवन अंगेनी माहिती 'प्रभावक चरित्र' नामना ग्रंथमांथी सत्तावार मणे छे.

हेमचन्द्राचार्य व्याकरण विषयक ग्रंथो, कोशग्रंथो, साहित्यग्रंथो, दर्शनग्रंथो, महाकाव्यो, इतिहासकाव्यो, स्तोत्रग्रंथोनी रचना करी छे. तद्दुपरांत '(लघु) अर्हनीति' जेवा नीतिशास्त्र विषयक ग्रंथनी पणा रचना करी छे. आचार्यश्रीनी ते समयमां प्रवर्तित तमाम विद्याशाखाना आधारभूत ग्रंथोनी रचना करी छे. उपरोक्त तमाम ग्रंथो उपर घण्टुं काम थयुं छे. परंतु, '(लघु) अर्हनीति' नामना ग्रंथ उपर घण्टुं ज ओढुं काम थयुं छे. परिषामे, आ ग्रंथ अल्पपरिचित रहेवा पाम्यो छे.

'(लघु) अर्हनीति' नाम उपरथी ज 'बृहदर्हनीति' ग्रंथ होवानी संभावना जणाय छे. वर्तमान समयमां 'बृहदर्हनीति' ग्रंथ उपलब्ध नथी. परंतु, '(लघु) अर्हनीति'मां अनेक स्थगे 'बृहदर्हनीति'नो उल्लेख करवामां आव्यो छे. आचार्यश्रीनी 'कुमारपाणना आग्रही व्याकरण' लघु रचायेला 'बृहदर्हनीति' शास्त्रमांथी कंटक सार लઈने राजा तथा प्रजाओना हित माटे शीक्ष समरणमां रभाय तेवुं अने सहेलाईथी समज शकाय तेवुं आ '(लघु) अर्हनीति' नामे सत्तशास्त्रनी रचना करुं छुं^१ तेवुं कह्युं छे. '(लघु) अर्हनीति'नो मूळ 'बृहदर्हनीति' ग्रंथ प्राकृत मागधीमां रचायेलो ग्रंथ हशे. तेना घण्डा श्लोको '(लघु) अर्हनीति'मां टांकवामां आव्या छे.^२ ते उपरथी तेमज दरेक प्रकरणाना अंते पुष्पिकामां विशेष ज्ञानवानी ईच्छावाणाए 'बृहदर्हनीति' नामनो ग्रंथ ज्ञोई लेवो, तेवी भलामण करवामां आवी छे. आथी कही शकाय के आ '(लघु) अर्हनीति' ग्रंथ अे 'बृहदर्हनीति' ग्रंथनी लघु आवृत्ति होवी ज्ञोईअ. केटलाक विवेच्यको अने इतिहासकारो '(लघु) अर्हनीति'ना ग्रंथने अन्यकर्तुक होवानुं जणावे छे. केटलाक विद्वानोनुं कहेवुं छे के जे '(लघु) अर्हनीति' हेमचन्द्राचार्यनो ग्रंथ होय तो तेमना अन्य ग्रंथोनी माझक तेनी प्रमाणाता केम टांकवामां आवती नथी? बीजु एक दलील मुजब आ ग्रंथनी प्रत घण्डा भंडारोमां मणती नथी, ते दलील सामे '(लघु) अर्हनीति' ना भाषान्तरकर्ता (सेवक भगुभार्द फेतहयंद करभारी '(लघु) अर्हनीति': प्रस्तावना पृ-६) नुं कहेवुं छे के आ ग्रंथनी घण्डी ज़ुर नहीं पडवाथी तेनी घण्डी प्रतो थयेली नहि. छतां, पाटणाना भंडारमां २७ नंबरना दाखामां १८ मा नंबरनी प्रत ज्ञोई लेवी. आचार्यश्रीनी ग्रंथारंभे जणाव्युं छे तेम कुमारपाण राजानी विनंतीने

ધ્યાનમાં રાખી આ ગ્રંથ રચાયો છે. ‘જિનાગમે’ જેવા શબ્દ પ્રયોગ જૈન આગમ સંબંધી સાક્ષી પૂરે છે, આ ગ્રંથના ચતુર્થ અધિકારનું ‘પ્રાયશ્ચિત’ પ્રકરણ પણ કર્તાનું જૈન ધર્મ સંબંધી ઉંડું જ્ઞાન દર્શાવે છે.

‘(લઘુ) અર્હનીતિ’ ગ્રંથ કુમારપાળના સમયમાં સંવત ૧૨૦૦ માં રચાયો છે. ગ્રંથનો પ્રથમ અનુવાદ ૧૯૦૧ માં નિર્ણયસાગર પ્રેસમાંથી પ્રકાશિત થયેલો છે. પૂજ્યપાદ મુનિરાજની પ્રત ઉપરથી લખાયેલી પૂજ્યપાદમુનિ મહારાજ વિધાસાગર ધર્મોપદેષા ન્યાયરત્ન શાંતિવિજ્યજીની પ્રતનો અનુવાદ મહીલાલ નાથુભાઈ દોસી (જેઓ ગુજરાત કોલેજ ના ફેલો હતા) એ કર્યો. આ ગ્રંથમાં ત્રણ બાબતોની ખામી જોવા મળે છે. આ ગ્રંથમાં મૂળ શ્લોક આશરે ૮૦૦ કે ૮૧૮ છે. તેમાંથી કેટલાક અધરા શ્લોકોની ઉપર ટીકા આપવામાં આવી છે. બાકીના શ્લોકોનો માત્ર અનુવાદ આપવામાં આવ્યો છે.

‘(લઘુ) અર્હનીતિ’

‘ણિત્ર પ્રાપણે’ ધાતુથી સ્ત્રીયાં કિન્તુ’ પ્રત્યય દ્વારા નિષ્પન્ન થયેલો ‘નીતિ’ શબ્દ કે જેના દ્વારા પ્રજ્ઞાને સદાચારમાં લાવી શકાય છે અને કુમાર્ગેથી હટાવી સારા માર્ગ ઉપર લાવી શકાય છે. ‘નીતિશાસ્ત્ર’, ધર્મનો પર્યાયવારી શબ્દ છે. સંસ્કૃત સાહિત્યમાં ‘શુક્રનીતિ’, ‘વિદૂરનીતિ’, ‘ચાણકયનીતિ’ જેવા અનેક નીતિ વિષયક ગ્રંથો રચાયા છે. જેમાં સામાન્ય હિતબોધ વિષયક ચર્ચા જોવા મળે છે. પરંતુ, ‘(લઘુ) અર્હનીતિ’ ગ્રંથમાં હિન્દુધર્મને માન્ય ‘યાજ્ઞવલ્ક્ય’ સ્મૃતિની માફક અનેક ગંભીર રાજકીય, વ્યવહારિક તથા પ્રાયશ્ચિત્તાદિક પ્રકરણોનું સંવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. જો કે ‘લઘુઅર્હનીતિ’ ગ્રંથના નામકરણથી જ ઘ્યાલ આવી જાય છે કે અહીં ‘યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ’ જેટલું વિસ્તૃત વિવેચન નથી છતાં ૧. ભૂમિકાભૂપાલ ગુણવર્ણન ૨. યુદ્ધ તથા દંડનીતિ ૩. વ્યવહારનીતિ વર્ણન અને ૪. લૌકિક પ્રાયશ્ચિત્તવિધિ વર્ણન જેવા વિષયોની ૮૦૦ કે ૮૧૮ જેટલા શ્લોકોમાં ચર્ચા કરી છે. શક્યયતઃ બધા વિષયો આવવી લેવાયા છે.

લોકો પરસ્પરના વ્યવહારમાં એકબીજા સાથે કેવી રીતે વર્તે કે જેથી પોતાનું હિત સાધી શકે અને સામા મનુષ્યને નુકશાન ન થાય તેવી રીતીને બતાવનારો અર્હદ્વ ભગવાને પ્રરૂપેલો આ લઘુ ગ્રંથ લોકોપ્યોગી છે. ગ્રંથારંભે મંગલાચરણમાં પ્રથમ (ઝગ્ભભદેવ) તથા છેલ્લા તીર્થકર (મહાબીર સ્વામી) નું તેમજ ગ્રંથના મધ્યમાં બાકીના બાવીસ તીર્થકરોને વંદન કરીને વિષયવસ્તુનું વિવેચન કર્યું છે. મંગલાચરણના છેલ્લા શ્લોકોમાં વિનમ્રભાવે કવિ કહે છે - ‘સદ્ગુરુ, શાસ્ત્ર અને સરસ્વતીને હું વારંવાર નમું છું, કારણ કે તેમની કૃપાથી જ મારામાં જ્ઞાન ઉદ્ય પામ્યું છે અને વિસ્તાર પામ્યું છે’^૧

‘પ્રાયશ્ચિત’ની વિભાવના

‘પ્રાયશ્ચિત’નો શાબ્દિક અર્થ છે ‘પાપોનું પરિશોધન કરનાર’ અને બીજો અર્થ છે ‘પાપોથી છૂટવા માટે ધાર્મિક સાધના’^૨ હેમાદ્રિએ પ્રાયશ્ચિતમાં ‘પ્રાયઃ’ નો અર્થ સાંધુવું અર્થાત્ ‘એક સાથે જોડવું’ તેવો લીધો છે. આ રીતે પ્રાયશ્ચિતનો અર્થ થાય - ‘જે ના થઈ ગયું છે તેની પૂર્તિ કરવી’^૩

વૈદિક સાહિત્યમાં ‘પ્રાયશ્ચિત’ અને ‘પ્રાયશ્ચિત’ એમ બે શબ્દો પ્રયોજાય છે. બંનેનો અર્થ પણ એક જ છે. જો કે ‘પ્રાયશ્ચિત’ શબ્દ વધુ પ્રાચીન જ્ઞાય છે. તૈતીરીય સંહિતામાં ‘પ્રાયશ્ચિતે’ શબ્દ જ અનેકવાર પ્રયોજાયેલો છે.^૪ વેદોમાં પણ પ્રાયશ્ચિતનો ઉલ્લેખ છે - ‘પ્રાયશ્ચિત્યૈ સ્વહા’ (યજુર્વેદ : ૩૮/૧૨)

કોષિતક બ્રાહ્મણ (૬/૧૨) અનુસાર - ‘લોકોનું કથન છે કે કેટલાક પણોમાં ખામીઓનો અતિરેક થાય તો તેનો પ્રભાવ પુરોહિત ઉપર પડે છે. તે ત્રણેય વેદપાઠ દ્વારા તેનું પ્રાયશ્ચિત કરે છે. આ શબ્દ અર્થવેદ (૧૪/૧/૩૦) વાજસનેયી સંહિતા (૩૬/૧૧) વગેરેમાં પણ પ્રયોજાયેલો છે. ‘આશ્વલાયન’ શ્રૌતસૂત્ર તથા ‘શાંખાયન’ શ્રૌતસૂત્રમાં પણ આ બંને શબ્દ એક જ અર્થમાં પ્રયોજાયેલો છે - ‘વિધ્યપરાધૈ પ્રાયશ્ચિતિ’^૫ તથા ‘વિધ્ય પરાધૈ પ્રાયશ્ચિત્તમ् અર્થલોપે પ્રતિનિધિ’^૬ પારસ્કર ગૃહસૂત્રમાં પણ ‘પ્રાયશ્ચિત્તિ’નો પ્રયોગ થયેલો જોવા મળે છે.^૭ જેમનીય સૂત્રની વ્યાખ્યામાં ‘પ્રાયશ્ચિત્ત’ની સ્પષ્ટતા કરતાં કહ્યું છે - યજ્ઞવિષિયાં પ્રમાદથી કે યજ્ઞોપકરણ પડી જવાથી જે ગરબડ થાય તેના કુપ્રભાવના સુધાર માટે પ્રયોગ થાય છે અને કેટલીક જગ્યાએ તેનો

પ્રયોગ વ્યક્તિએ સારી રીતે કૃત્ય ન કર્યું હોય, તેનું સમાધાન થઈ જાય તે માટે, અથવા વ્યક્તિએ કોઈ નિષિધ્ય કાર્ય કર્યું હોય તો તેનું નિવારણ આ પ્રાયશ્ચિત દ્વારા થઈ જાય.⁹ ‘શતપથ’ એને ‘ઔતરેય’ બ્રાહ્મણ ગ્રંથોમાં મનોરંજક દણાંતો દ્વારા ‘પ્રાયશ્ચિત’ નો અર્થ સ્પષ્ટ કર્યો છે.¹⁰

અધિકાંશો આ શબ્દની વ્યુત્પત્તિ ‘પ્રાયः’ (તપ) તથા ‘ચિત’ (સંકલ્પ કે દઢ વિશ્વાસ) જોવા મળે છે, જેનાથી પાપ દૂર થઈ જાય. આ પાપનાશ માટે કરવામાં આવે છે તેથી કામ્ય પણ છે.¹¹ આવાં ‘કામકૃત’ (જાહી-જોઈને કરવામાં આવે તે કર્મ) અને ‘અકામકૃત’ (અજાણતામાં થતાં કર્મ) એમ બે પ્રકારનાં કર્મ છે.

પ્રાયશ્ચિત કરવાથી પાપનું નિવારણ અવશ્ય થાય છે, આવું બધા સ્મૃતિગ્રંથો આદિથી તથ્ય નિષ્પન્ન થાય છે. પ્રાચીનકાળથી જ પરિષદ (સભા) પ્રાયશ્ચિત માટે પોતાના સ્વયં નિયમો નિર્ધારિત કરતી હતી. વ્યવસ્થિત પ્રાયશ્ચિત ન કરે તેને મહાપાતકી કે ઘટસ્ફોટ કરીને જાતિ (જાતિ) માંથી બહાર કાઢી મૂકવામાં પણ આવતો. આને ‘જાતિંડ’ પણ કહી શકાય.¹² મહાપાતકોનું પ્રાયશ્ચિત બહુ ભયંકર હતું. ધી, ગોમૂત્ર, જળ કે દૂધ એટલી હદ સુધી પીવું કે મૃત્યુ થઈ જાય. ત્યારે જ તેની શુદ્ધિ થાય છે. કદાચ કોઈ અજાણતામાં સુરા પી લે તો કૃચ્છ્ર પ્રાયશ્ચિત દ્વારા તેની શુદ્ધિ થઈ જાય છે.¹³

આમ, પ્રાયશ્ચિત સંબંધી સાહિત્ય બહુ જ વિશાળ છે. પ્રાચીન સમયના સમાજમાં બહુ જ મહત્ત્વ હતું. પુરાણ સાહિત્યમાં ‘અનિપુરાણ’ (૧૬૮-૧૭૪), ‘ગારુડ પુરાણ’ (પર) ‘કૂર્મ પુરાણ’ (ઉત્તરાર્ધ-૩૦-૪૦), ‘વરાહપુરાણ’ (૧૩૧-૧૩૬), ‘બ્રહ્મપુરાણ’ (ઉપસંહારવાદ અ.દ) આદિમાં પ્રાયશ્ચિત વિધાન જોવા મળે છે. પાપી એ પરિષદ પાસે જઈને વસ્તુ ભેટ આપવા ઉપરાંત પાપનો ઉદ્ઘોષ કરીને ‘પ્રાયશ્ચિત’ વિધયમાં સંમતિ લેવી જોઈએ (યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ -૩/૩૦૦ અને પરાશર સ્મૃતિ: ૮/૨) પ્રાયશ્ચિત ન કરનાર પાપીએ નરકમાં યાતનાઓ ભોગવવી પડતી હતી.¹⁴ બૌધાયન ધર્મસૂત્ર અનુસાર જીવજંતુઓની હત્યાના પ્રાયશ્ચિતની વાત કરેલી છે. ‘વિષ્ણુધર્મ સૂત્ર’ (૩૫/૬) અનુસાર અશ્વમેધ યજ્ઞ અથવા પવિત્રસ્થાનોની યાત્રા કરવાથી મહાપાતકી પાપોથી મુક્ત થઈ જાય છે.

મનુએ પ્રાય: નો અર્થ ‘તપ’ અને ‘ચિત’ નો અર્થ ‘નિશ્ચય’ એમ પ્રાયશ્ચિતનો અર્થ ‘તપ કરવાનો નિશ્ચય’ એવો લીધો છે¹⁵ કાઢ સહન કરતાં કરતાં તે મનુષ્ય નકી કરે છે કે આવું પાપ ફરીથી નહિ કરું. આ ‘પ્રાયશ્ચિત’ કહેવાય. આગળ મનુ કહે છે - ‘શાસ્યોક્ત કર્મ (નિત્ય સંન્ધોપાસન, શબ સ્પર્શ કર્યા પછી સ્નાનાદિ) ન કરનાર અને ઈન્દ્રિયોના વિષયોમાં અત્યંત આસક્ત થનારો મનુષ્ય પ્રાયશ્ચિત માટે યોગ્ય કહેવાય છે.’ (મનુસ્મૃતિ: ૧૧/૪૪) ‘જે મનુષ્ય પોતાની ઈચ્છાથી પાપ નથી કરતો તેવા મનુષ્યનાં પાપ વેદાભ્યાસથી નાચ થઈ જાય છે તથા રાગ-દ્રેષાદિ-મોહથી વશીભૂત થઈને પોતાની ઈચ્છાથી કરેલાં પાપ વિભિન્ન પ્રકારનાં પ્રાયશ્ચિતથી નાચ થાય છે.’ (મનુસ્મૃતિ ૧૧/૪૬) પ્રાયશ્ચિત કરવાનું લક્ષ્ય જ ‘પાપ નિવૃત્તિ’ (મનુ ૧૧/૫૩) મનુ એ પ્રાયશ્ચિતની અનિવાર્યતા અંગે કહું છે - ‘જે મનુષ્ય પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત નથી કરતો તેની સાથે કોઈપણ પ્રકારનો સાંસક્રિક વ્યવહાર ન કરવો જોઈએ અને જે મનુષ્યે પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે તેનાં પાપો સંબંધે કોઈએ તેની નિંદા ન કરવી જોઈએ.¹⁶ યાજ્ઞવલ્ક્ય - ‘પ્રાયશ્ચિતને બધાં પાપોના પૂર્વશોધક માનતા નથી. તેમના મતે-એવા પાપી વ્યક્તિ સાથે કોઈપણ સામાજિક સંબંધ ન રાખવો જોઈએ અને તેના સંપર્કમાં આવનાર બાળક અને સ્ત્રી હોય તો પણ વધ કરવો. કારણ કે પાપનું પ્રાયશ્ચિત પણ કરી લે, તો પણ તે મનુષ્ય સંબંધ રાખવા માટે યોગ્ય નથી હોતો.’¹⁷ યાજ્ઞવલ્ક્ય પાપી માટે પ્રાયશ્ચિતની આવશ્યકતાનો સ્વીકાર કરતાં કહે છે - ‘જે મનુષ્ય પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત નથી કરતો તે ભયંકર નરકમાં જાય છે. આ રીતે સ્પષ્ટ છે કે મનુષ્યે પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું જોઈએ. (યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ૩/૨૨૧) ‘શાતાતપ’ સ્મૃતિ મુજબ ‘જે મનુષ્ય પાપ કર્મ કર્યા પછી પણ પ્રાયશ્ચિત નથી કરતો તેને નરક ભોગવ્યાનાં પાપને સૂચિત કરનારાં કેટલાંક ચિન્હ બીજા જન્મમાં પણ દેખાય છે.’¹⁸

દંડનો પ્રાયશ્ચિતાત્મક સિધ્યાન્ત એ છે કે ગુનેગારને દંડિત કરવાથી પોતે કરેલાં કુકર્માનો પ્રાયશ્ચિત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય કે આત્મગલાનિ પેદા થાય. આમ, પશ્યાતાપની આગમાં બળીને સ્વયંને સુધરવાનો સંકલ્પ કરે અને સદાચારી વ્યક્તિની જેમ

ફરીથી જીવન શરૂ કરે છે. શુજરાતી કવિ કલાપીએ પણ એક કાવ્યમાં પ્રાયશ્ચિત વિશે કહું છે ‘હા પસ્તાવો વિપુલ જરણું સ્વર્ગથી ઉત્ત્યું છે, પાપી તેમાં દૂબકી દઈને પુણ્યશાળી બને છે.’

‘(લઘુ) અહનીતિ’ માં પ્રાયશ્ચિત વિચાર’

હેમચન્દ્રાચાર્ય ‘લઘુઅહનીતિ’ ગ્રંથના ‘લૌકિક પ્રાયશ્ચિતવિધિ’ વર્ણન નામના ચોથા અધિકારમાં ‘પ્રાયશ્ચિત’નું નિરૂપણ કર્યું છે.

કવિશ્રીએ ચોથા અધિકારના આરંભે ચિદાનંદરૂપ યોગમાર્ગથી કરેલા ધ્યાનના વડે જ લક્ષમાં આવે એવા તથા આઠ કર્મરૂપી શત્રુઓને જેમણે નાટ કર્યા છે એવા શ્રી ‘પ્રાર્થનાથ’ પ્રભુને નમસ્કાર કરીને મંગલ કર્યું છે.

ત્રીજા અધિકાર (વ્યવહારનીતિ) ના અંતિમ પ્રકરણ ‘શ્રી-પુરુષ ધર્મ’નું નિરૂપણ કર્યું હતું. તે ધર્મમાં પ્રાયશ્ચિતની આવશ્યકતા છે અને લૌકિક પ્રાયશ્ચિતનું વ્યવહારાંગપણું છે, તેને લીધે શાતિ દંડનીતિને નીતિ સાથે સાહચર્યપણું હોવાથી કવિ આ અધિકારમાં પ્રાયશ્ચિતનું વર્ણન કરે છે. (લ.અ. ૪/૧ ની ટીકા)

ચાંડાળ, ધવન, મ્લેચ્છ આદિના ધરમાં ભોજન કરનારે પ્રાયશ્ચિત કરવું પડે (પદ્ય-૨) તે સંદર્ભે કેવું પ્રાયશ્ચિત કરવું પડે તે અંગે કવિ કહે છે- ‘પચાસ ઉપવાસ, પચાસ એકાસણાં, પાંચ તીર્થયાત્રા, પાંચ સધર્મી વત્સલ, શાંતિસ્નાત્ર સહિત જિનોની પંચપૂજા, સંધભક્તિ, ગુરુભક્તિ, યથાવિધિ દાન, જિનશાસ્ત્ર મુજબ યજ્ઞોપવીત (જનોઈ) સંસ્કાર, દેવદ્રવ્યની વૃદ્ધિ, જ્ઞાનવૃદ્ધિ તથા જ્ઞાતિ ભોજન આ બધું કરી સર્વ ઔષધિ મેળવેલું તીર્થનું જળ તથા તીર્થની માટીથી સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. આ મુજબ જો પ્રાયશ્ચિત ન કરે તો તેને જ્ઞાતિ બહાર કરવો. તે પોતાની પંક્તિમાં ભોજન કરવા ન બેસી શકે. તે (વ્યક્તિ) ની સાથે જો અન્ય વ્યક્તિ જમે તો તેને પણ જ્ઞાતિ (સમાજ)માંથી બહિષ્કૃત જાગ્રત્વો (કરવો)’ (લ.અ. : પદ્ય-૩-૭)

ભીલ તથા મોચીના ઘેર ભોજન કરનાર માટે જૈનશાસ્ત્રમાં કુશળ એવા વિદ્બાનોએ તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કહું છે, તે અંગે કવિ કહે છે - ‘ચાલીસ ઉપવાસ, ચાલીસ એકાસણાં, ચાર તીર્થયાત્રાઓ, ત્રણે સાધર્મી- વત્સલ તથા પૂર્વની પેઠે શાન્તિ સ્નાત્રાદિક સહિત ચાર જિનપૂજાઓ, સંધપૂજા, ગુરુપૂજા અનેક પ્રકારનાં દાન જૈન સંસ્કારથી જનોઈ આપવી, દેવદ્રવ્યની વૃદ્ધિ, જ્ઞાતિભોજન, તીર્થનાં જળ તથા મૃત્તિકાથી સ્નાન વગેરે પૂર્વે કહેલું સધળું કરે, ત્યારે પવિત્ર થાય છે. પ્રાયશ્ચિત ન કરે તો ભષ્પણાને લીધે જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે.’ (લ.અ.:પદ્ય-૮-૧૨)

અઠારે વર્ણ (બધી જ વણી) ના ઘેર જમવા બેસનારના પ્રાયશ્ચિત વિશે કવિનું કહેવું છે કે - ‘એકવીસ ઉપવાસ, એકવીસ એકાસણાં, ત્રણ તીર્થયાત્રાઓ, ગુરુસંધ તથા જ્ઞાનીઓની પૂજા, પાત્રદાન, દેવદ્રવ્યની વૃદ્ધિ, જ્ઞાતિભોજન, ઉપવીત ધારણ, ઔષધિયુક્ત તીર્થના જળથી સ્નાન એ સધળું પૂર્વની પેઠે આચરવું, ત્યારે જ તે પવિત્ર થાય અને ત્યારે જ તે મનુષ્ય પંક્તિમાં બેસવાને યોગ્ય થાય છે.’ (લ.અ : પદ્ય-૧ ઉ-૧ દ પૂર્વધી)

અજિન પાતાદિથી થતા દુર્મરણના પ્રાયશ્ચિત વિશે કવિ કહે છે - અજિનમાં પડીને કે એવા કોઈ આકસ્મિક કારણોથી દુર્મરણ થયું હોય તો તેની શુદ્ધિ માટે જિનશાસ્ત્રમાં આ મુજબનો દંડ કહેલો છે.’ (લ.અ. ૧ દ. ઉ. ૧૭.૫૦.) ‘પચાસ એકાસણાં, પચ્ચીસ ઉપવાસ, દસ આંબેલ, ત્રણ તીર્થયાત્રા, ત્રણ સાધર્મિક વત્સલ, જ્ઞાતિભોજન, ત્રણ જિનપૂજા, સત્યપાત્રો વિશે ઉત્તમ દાન, ગુરુ તથા સંધની પૂજા અને બાકીનું સર્વ પૂર્વની પેઠે આચરવું. એ પ્રમાણે કરે તો જ શુદ્ધ થાય નહિ તો (તે વ્યક્તિને) પંક્તિ બહાર (અર્થાત્ જ્ઞાતિ બહાર) મૂકવો’ (લ.અ.પદ્ય-૧૭.૩ થી ૨૦૫૦.) બ્રહ્મહત્વાદિક પાપ કરનારાઓની શુદ્ધિનો વિધિ આ મુજબ કહ્યો છે (લ.અ.૨૦.૩)

બત્રીસ ઉપવાસ, પચાસ એકાસણાં, વર્ધમાન તપની આંબળની ઓળી, ગુરુ પાસે આલોચના, પાંચ તીર્થયાત્રા, પાંચ જિન પૂજાઓ, સંધ-પૂજા, ગુરુભક્તિ, સ્વામી, વાત્સલ્ય, જ્ઞાનનું બહુમાન, જ્ઞાતિનું બહુમાન, સાતક્ષેત્રમાં ધનવ્યય તથા શુદ્ધભાવથી પાત્રદાન કરવાથી તે (મનુષ્ય) પવિત્ર થાય છે, નહિ તો તે જ્ઞાતિ બહાર થાય છે અને સર્વથા પ્રકારે જ્ઞાતિ દ્વારા અવશ્ય દંડવા યોગ્ય થાય છે. (પદ્ય-૨૧-૨૪ પૂ.)

ક્ષત્રિયાદિ ત્રણે વર્ણના પુરુષ શુદ્ધ સાથે અન્નપાણીનો વ્યવહાર રાખે તો તે મનુષ્યના પ્રાયશ્ચિત વિશે (૨૪.ઉ.-૨૫ પૂ.) કવિ કહે છે- ‘એક પૂજા, એક તીર્થયાત્રા, સતત નવ આંબલ, પાત્રદાન, સંઘભક્તિ, ગુરુભક્તિ અને જ્ઞાતિદંડ, આટલું કર્યા સિવાય તે (મનુષ્ય) પાપ મુક્ત થતો નથી. (લ.અ: ૨૫-ઉ. થી ૨૬)

મિથ્યાદિષ્ટ શુદ્ધે સ્પર્શોલાનું ભોજન કરનારના પ્રાયશ્ચિત વિશે કવિ કહે છે - (આવા મનુષ્યોને શુદ્ધ થવા માટે જૈનો (જિનો) કહે છે) કે- ‘વીસ આંબેલ, બાર ઉપવાસ, ત્રીસ એકાસણાં, સંઘ સેવા, પાત્રદાન, ગુરુ-સેવા, ત્રણ તીર્થયાત્રાઓ, જ્ઞાતિભોજન તથા જિનપૂજા આટલું કરવાથી તે શુદ્ધ થાય છે, નહિ તો જ્ઞાતિ બહાર થાય છે.’ (લ.અ: ૨૭ થી ૨૮)

પુત્રી, માતા તથા ચાંડાલી સાથે સંભોગથી થતા પ્રાયશ્ચિત અંગે કવિ કહે છે - ‘પુત્રી, માતા તથા ચાંડાલી સાથે સંભોગ કરવાથી જે પાપ થાય છે તે પાપથી ધૂટવાને પચાસ ઉપવાસ, પચાસ એકાસણાં, તેત્રીસ આંબેલ, દશ છંદ, નવ અહૂમ, એક લાખ સ્વાધ્યાય, પાંચ તીર્થયાત્રાઓ, પાંચ જિનપૂજાઓ, ગુરુપૂજા, સંઘપૂજા તથા પાત્રદાનાદિક પૂર્વની પેઠે કરવા એ પ્રકારે કરવાથી તે શુદ્ધ થાય છે, નહિ તો જ્ઞાતિ બહાર મૂકવો’ (લ.અ: ૩૦ થી ૩૩ પૂ.)

કારીગરના ઘરમાં નિવાસ-ભોજન કરનારના પ્રાયશ્ચિત વિશે કવિનું કહેવું છે - ‘કારીગરના ઘેર નિવાસ કરનારને પાંચ ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે અને તેના ઘેર ભોજન કરનારને ચૌદ ઉપવાસથી શુદ્ધ મળે છે.’ (૩૩ ઉ. -૩૪ પૂ.)

ગૌહત્યા, બ્રહ્મહત્યાદિ કરનાર પાપીઓના અન્નભાનારના પ્રાયશ્ચિત વિશે કવિ કહે છે - ‘ગૌહત્યા, બાળહત્યા, સાધુહત્યા તથા સ્વી-હત્યા કરનાર પાપીઓના અન્નનું ભોજન કર્યું હોય તો શ્રેષ્ઠ એવા મુનિઓએ દશ ઉપવાસ શુદ્ધિ (પવિત્ર થવા) અર્થે કહેલા છે. (લ.અ : ૩૪ ઉ.-૩૫ પૂ.)

જેના ગોત્રમાં બેસીને ખાવાનું ન ખપે તેવી જગ્યાએ ભોજન કરનારના પ્રાયશ્ચિત માટે કવિ કહે છે - ‘ઔષધને બાબતે ગુરુ આદિનો નિગ્રહ કરવાથી અથવા ઔષધ બાબતે પારકાને બંધન કરવાથી મોટા પુરુષના અભિયોગથી અને પ્રાણની પીડા દૂર કરવાને અર્થે જેની જ્ઞાતિમાં બેસીને જે વસ્તુ ખાવી તથા પીવી ઉચિત નથી તેનું ભક્ષણ કરવાથી જે દોષ થાય તેની શુદ્ધિ ત્રણ ઉપવાસથી થાય. (લ.અ: ૩૫ ઉ.-૩૭ પૂ.)

મ્લેચ્છના દેશમાં રહેનારનું પ્રાયશ્ચિત અને તે વિશોધન પ્રાયશ્ચિત બાબતે કવિનું કહેવું છે - ‘મ્લેચ્છના દેશમાં રહેવાથી, તેમના આગ્રહથી મ્લેચ્છરૂપ થયો હોય, મ્લેચ્છના કેદખાનામાં રહેવાથી અથવા વસ્તુનું ભક્ષણ કરવાથી, ન પીવાની વસ્તુ પીવાથી, મ્લેચ્છાદિકોની સાથે ભોજન કરવાથી, વિવાહ ઈત્યાદિ કાર્યોથી, પરજ્ઞાતિમાં પ્રવેશ કરવાથી, અજ્ઞાનથી મહાહિંસા આદિ પાપ કરવાથી માણસે પ્રાયશ્ચિત કરવું પડે છે. તેની શુદ્ધિ વિશોધનથી થાય છે.’ (૩૭ઉ.૩૮)

વિશોધન પ્રાયશ્ચિત સ્વરૂપને વિસ્તારપૂર્વક કહે છે- ‘ત્રણ દિવસ વમન (ઉલટી) કરાવવું, ત્રણ દિવસ રેચ આપવો, વમનના દિવસોમાં લાંઘણા (ઉપવાસ) કરવી, રેચના દિવસોમાં જવ ચાવવા, ત્યાર પછી સાત દિવસ જમીન ઉપર સુવડાવી ઉપર ઉંબરાના લાકડાનો અજિન કરી તાપ આપવો. (૪૦-૪૨) બળદ તથા આખલો જોડી તેની પાસે હળવહન કરાવવું. અજિન સળગાવી તાપ લેવાના સાત દિવસો તથા હળવહનના સાત દિવસ મળી (કુલ) ચૌદ દિવસ સુધી માત્ર રોજ એક મુહ્ની જવ ખાવા. ત્યાર પછી થાના તથા દાઢી-મૂછના વાળ લેવડાવવા (અર્થાત્ દાઢી -મૂછ કઢાવવા પછી સાત દિવસ પંચગવ્યથી સ્નાન કરવું. તે સાત દિવસોમાં માત્ર ગાયનું દૂધ પીને રહેવું, બીજું કશુંય ભોજન કરવું નહિ. પછી પાંચ દિવસ સુધી ત્રણવાર ત્રણ હથેળી ભરી પંચગવ્યથી આચરણ કરવું. ત્યાર પછી મુંડન કરાવવું. પછી તીર્થોદકના સમૂહથી એકસો આઠ ઘડાથી સ્નાન કરાવવું. વળી, દેવના સ્નાનના જળથી તથા ગુરુના ચરણ પ્રક્ષાલન (પગ ધોયેલા) જળથી સ્નાન કરાવવું. સ્નાન કરી શુદ્ધ થયા પછી સાવધાન થઈ દેવ તથા ગુરુને નમસ્કાર કરવા. પછી નિર્મળ બુદ્ધિ રાખી સાધુ તથા સંઘનું પૂજન કરે. દાન શાનવૃદ્ધિ તથા ત્રણ તીર્થયાત્રાઓ કરે, એ પ્રકારે આચરણ કરે તેને ‘વિશોધન’ પ્રાયશ્ચિત કહેવાય છે. આ પ્રમાણે સર્વ દેહધારીઓની વિશુદ્ધિનું વર્ણન કવિએ ટૂંકમાં કર્યું. કવિ કહે છે. જે વિદ્વાનોને વિશોધ જાળવાની ઈચ્છા હોય તેમણે બીજા ગ્રંથોમાંથી જાણી લેવું. (૪૩-૫૦) (અહીં લૌકિક પ્રાયશ્ચિત - વિધિવર્ણન' નામનો ચતુર્થ અવિકાર સમાપ્ત થાય છે.)

કવિશ્રી હેમચન્દ્ર જૈનધર્મી હોવાને લીધે ‘ઈહનીતિ’ના પ્રાયશ્રિત વિચારમાં પણ જિનશાસ્કોકત તપનો પ્રભાવ દષ્ટિગોચર થાય છે. જેમ કે- ચાંડાળ, ધવન, મ્લેચ્છ, ભીલ કે દરેક વર્ણના ધેર ભોજન જમનાર, મિથ્યાદષ્ટિ શૂદ્ર સ્પર્શોલું ભોજન જમનારનું પ્રાયશ્રિત, અનિનપાતાદિથી થતા દુર્મરણનું પ્રાયશ્રિત, બ્રહ્મહત્યાદિ પાપ કરનારનું પ્રાયશ્રિત, ક્ષત્રિયાદિ ત્રણે વર્ણ સાથે અને શૂદ્ર સાથે અન્ન-પાણીનો વ્યવહાર રાખનાર મનુષ્યનું પ્રાયશ્રિત, પુત્રી માતા તથા ચાંડાલી સાથે સંભોગથી થતું પ્રાયશ્રિત, કારીગરના ધરમાં નિવાસ- ભોજન કરનાર, ગૌહત્યા, બ્રહ્મહત્યાદિ કરનાર પાપીઓનું અન્ન મનારે પ્રાયશ્રિત કરવું જ પડે તો જ તે મનુષ્યની શુદ્ધિ થાય છે અર્થાત્ પવિત્ર થાય છે. કવિએ કહેલા આ પ્રાયશ્રિતમાં પણ જિનશાસ્કોની જ અસર વર્તાય છે. જેમ કે આ પ્રકારનાં પાપોનું પ્રાયશ્રિત-ત્રત, ઉપવાસ, એકાસણાં, આંખલ, તીર્થયાત્રા, જિનપૂજા, સંઘભક્તિ, ગુરુભક્તિ, દેવ દ્રવ્યની વૃદ્ધિ, જ્ઞાનીઓની પૂજા, જ્ઞાનવૃદ્ધિ, તીર્થની માટી દ્વારા સ્નાન, જ્ઞાતિમાંથી (સમાજ) બહિષ્કૃત કરવો, પંક્તિમાં ભોજન ન કરવા દેવું, ઉપવીત ધારણા, તીર્થ જળ અને મૃત્તિકા (માટી)થી સ્નાન, પાત્રદાન, આદિ દ્વારા કરવાનો ઉલ્લેખ જોવા મળે છે.

પ્રાયશ્રિત પ્રકરણના અંતે કવિ કહે છે. મ્લેચ્છરૂપ દેશમાં રહેવા, જમવા કે વિવાહ ઈત્યાદિ કાર્યો કે પરજ્ઞાતિમાં પ્રવેશ કરવાથી કે અજ્ઞાનવશ મહાહિંસા (મહાપાતક) આદિ પાપનાં પ્રાયશ્રિત ‘વિશોધન’ પ્રાયશ્રિત દ્વારા જ થાય છે. અર્થાત્ વિશોધનથી જ શુદ્ધિ થાય છે.

‘વિશોધન’ પ્રાયશ્રિતના સ્વરૂપમાં કવિ-વમન, રેચન, ઉપવાસ, જવ ચાવવા, જમીન ઉપર સુવડાવવો, ઉભરાના લાકડાના અનિન દ્વારા તાપ આપવો, બળદ કે આખલો જોડીને હળવહન કરાવવું, પંચગવ્ય સ્નાન, પંચગવ્ય આચમન, તીર્થોદકથી સ્નાન, દેવસ્નાનના જળથી કે ગુરુ પ્રક્ષાલન જળથી સ્નાન, દેવગુરુને નમસ્કાર, સંધ-સાધુ પૂજન, જ્ઞાનવૃદ્ધિ દાન આદિની વાત કરી છે. અંતે, કવિએ વિશોધ જાણવાની ઈચ્છાવાળા વિદ્વાનોએ બીજા ગ્રંથોમાંથી જાણી લેવું (પદ્ય-પૠ) અન્ય શાસ્કોમાંથી જાણવાનો અર્થ અર્થાત્ ધર્મશાસ્કોના ગ્રંથોના અભ્યાસ તરફ સંકેત હોઈ શકે. સ્મૃતિશાસ્કો આદિ ધર્મશાસ્કોના ગ્રંથોમાં પૂર્વ ‘પ્રાયશ્રિત’ વિચાર કરવામાં આવેલો છે, પરંતુ તે થોડોક બિન્ન જણાય છે.

મનુષે બ્રહ્મહત્યાના પ્રાયશ્રિત અંગે કહું છે - ‘બ્રાહ્મણની હત્યા કરનાર મનુષ્ય પોતાનાં પાપની શુદ્ધિ માટે બાર વર્ષ સુધી વનમાં કુટિર બનાવીને અને તે (મૃત બ્રાહ્મણને અથવા તે ન મળતાં બીજા કોઈના મસ્તક)ને ચિન્હ રૂપે પોતાની સાથે લઈને ભોજન કરે તથા મુંડનવાળા મસ્તકવાળો થઈને રહે.¹⁰ મનુ અને યાજવલ્કયે ‘બ્રહ્મહત્યા, મધ્યપાન, બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરવી, ગુરુ પત્ની સાથે સંભોગ, આ ચારેય પાપ કરનાર પાપીની સાથે એક વર્ષ સુધી સંસર્ગમાં રહેનાર આ પાંચેયને મહાપાતક કહ્યાં છે’¹¹ મહર્ષિ ગૌતમ બ્રાહ્મણની હત્યાના પ્રાયશ્રિત વિશે કહે છે કે ‘તેવા મનુષ્યે ભોજન છોડી દેવું જોઈએ. જો શરીર કમજોર થઈ જાય તો અનિનમાં કૂદવું જોઈએ. અથવા યુદ્ધના મેદાનમાં જઈને સ્વયં જ કોઈ યોધાના શક્યનું નિશાન બનીને પ્રાયશ્રિત પૂરું કરવું જોઈએ અથવા બાર વર્ષ સુધી બ્રહ્મયર્થનું પાલન કરવું. ગામમાં કે નગરમાં માત્ર બિક્ષા અર્થે જ જવું. હાથમાં ચારપાઈનો એક પાયો અને નરકપાલ લઈને પાપની ઘોષણા કરતાં જીવન વીતાવે. રસ્તામાં કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય મળે તો તેમના માટે રસ્તો કરી આપે. ટિવસે ઉભા રહેવું, રાત્રી બેસીને પસાર કરવી, દરરોજ સવાર બપોર અને સાંજે સ્નાન કરે. આવું સતત ચાર વર્ષ સુધી કરવાથી તે મનુષ્ય પવિત્ર થાય છે અથવા કોઈ બ્રાહ્મણનો પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરે ત્યારે તે પાપમાંથી મુક્ત થઈ શકે અથવા તો કોઈ બ્રાહ્મણનું ચોરી થયેલું ધન પાછું લાવી આપવા સંધર્ષ કરતાં શરીરથી ઘાયલ થાય તો તેનાં પાપ ક્ષીણ થાય છે અથવા અશ્વમેધ પઢી કરવામાં આવતા અવભૂથથી સ્નાન કરે તો પાપથી મુક્તિ પામે કે પઢી અનિષ્ટુત યજામાં ભાગ લે, ત્યાં સ્નાન કરવાથી તેનાં પાપ દુર થાય’¹²

યાજવલ્કય ઉપપાતકોમાં ગોવધને સૌ પ્રથમ શ્રેષ્ઠીમાં મૂકે છે. તેમના મતે ‘ગાયની હત્યા કરનાર ‘પંચગવ્ય’ (ગોમૂત્ર, ગોબર, દૂધ, દહીં, ધી) પીને એક માસ સુધી સંયમિત જીવન જીવે. ગૌશાળામાં સૂતું, ગાયોની પાછળ ચાલતું અર્થાત્ ગૌ સેવા કરવી અને માસને અંતે એક ગાયનું દાન કરવાથી શુદ્ધ થાય છે. આ ઉપરાંત સાવધાન થઈને એક મહિના સુધી કૂચ્છુ અને અતિકૂચ્છુ વ્રત કરવું તથા દિન-રાત ઉપવાસ કરીને દસગાયો અને એક બળદાનનું દાન કરવાથી તે શુદ્ધ થાય છે.²⁰

‘सामान्य प्रायश्चित्’ उपरांत याजवल्क्यज्ञे एक अलग प्रकारना ‘रहस्य-प्रायश्चित्’ नो पश्च उल्लेख कर्यो छे. ‘पाप करनार सिवाय कोई न जाणतुं होय तेने ‘रहस्य प्रायश्चित्’ कहे छे. याजवल्क्य ब्राह्मणी हत्या करनारने त्रष्ण दिवस उपवास करीने, पाणीमां उभा रहीने अधर्मर्षण ऋषिनुं सूक्त ‘ऋतं च सत्यं चं’ आदिनो जप करीने एक दूध आपनारीने गायनुं दान करीने शुद्ध थर्द शके छे. आ उपरांत दिन-रात उपवास करीने रातभर जग्नां रहीने, प्रातः काणे जग्नांथी नीकणीने ‘लोमभ्यः स्वाहा’ आदि आठ मन्त्रोथी प्रत्येक मन्त्रनी साथे पांच-पांच आहुति आपीने चालीसवार आहुति आपीने शुद्ध थाय छे. आ ज अत्महत्यानुं ‘रहस्य - प्रायश्चित्’ छे.

‘सुरा (महिरा) पान’ प्रायश्चित अंगे मनु अने याजवल्क्यज्ञनुं कहेवुं छे - ‘जे मनुष्य जाणी-जोईने सुरापान करे छे ते मुख द्वारा उक्णती सुरा, धी, जग, मूत्र के दूध आदि एटलुं बधुं पीवे के तेनुं मृत्यु थर्द जाय. त्यारे ज तेनी शुद्धि थाय छे. अजाणतामां सुरा पीले तो कृच्छ्र प्रायश्चित द्वारा तेनी शुद्धि थर्द जाय छे.’²² आम, धर्मशास्त्राना ग्रंथोमां प्रायश्चित विशे धारी चर्चाओ प्राप्त थाय छे. आचार्यशी हेमचन्द्र निभवर्णना मनुष्योने घेर जग्नार के निभवर्णना मनुष्ये स्पर्शेल भोजन करनारनुं पश्च प्रायश्चित कह्युं छे.

मानवीनी प्रकृति बहु ज विचित्र होय छे. केटलाक मनुष्यो धर्मशास्त्रमां प्रतिपादित आचार तथा श्रेष्ठज्ञो द्वारा निर्दिष्ट मार्गनुं ज अनुसरण करे छे अथवा करवानो प्रयत्न करे छे. तेवा लोको साधु प्रकृतिनी व्यक्तिओ होय छे. जो तेमनाथी कोई असत्य आचरण थर्द जाय छे तो ते तेमनुं प्रवृत्तिजन्य कृत्य नथी होतुं. असावधानी के अज्ञानताने कारणे थर्द जाय छे. आनाथी विपरीत प्रकृतिना व्यक्ति-निर्दिष्ट मार्ग पर चालवानुं पसंद नथी करता पोताना कलुषित मनोभावने कारणे कुटिल तथा लोभी प्रकृतिने कारणे तेओ केवण पेय सुख तरफ दोडे छे. श्रेयथी तेमने कांઈ लेवा-टेवा होतुं नथी. तेओ द्वारा थेलुं अशिष्ट आचरण तेमनुं स्वेच्छाकृत होय छे. ऐवुं खोटुं कार्य करीने पश्च तेओना मनमां कोई ज प्रकारनी ज्लानि, पश्चाताप के हुःभ थतुं नथी. योग्य असवर प्राप्त थतां ज ते कक्षाना आचरणने पुनःपुनः करवा प्रवृत्त थाय छे, आवा प्रकारना मनुष्योने प्रायश्चित साथे कंઈ ज लेवा-टेवा होतुं नथी. तेवी व्यक्तिओने सन्मार्ग उपर लाववानुं कार्य तो मात्र दंड ज करी शके छे. सज्जन मनुष्यो द्वारा खराब आचरण थयुं होय तो तेमना चिनामां पश्चाताप, आत्मग्लानि वगोरे थाय छे. प्रायश्चित मनुष्यने सुधरवानो मोक्षो आपे छे. जो के दंड पश्च ते ज कार्य करे छे. प्रायश्चित व्यक्तिगत अनुभूति अने चिन्तननुं परिषाम छे. तेमां सामाजिकतानुं पश्च योगदान छे.

आजनो मानव हररोज जाणे-अजाण्ये केटलांक कार्यो अेवां करे छे के करवां पडे छे, जे कर्या पछी तेनुं चित अशान्त थर्द जाय छे. मन उद्देशित थर्द जाय छे. आत्म विकारनो भाव आत्मग्लानिने जन्म आपे छे, क्यारेक तो ते मनुष्य पोतानी ज दृष्टिमां एटलो बधो लज्जित थर्द जाय छे के हुर्भूषितथी प्रेराईने ते आत्महत्या करी बेसे छे. आवा समये जो धर्मशास्त्रोना ग्रंथोमां के ‘(लघु) अर्हन्नीति’ जेवा ग्रंथोमां उपदेशेल प्रायश्चितनो विकल्प मणी जाय तो ते अवश्य आवुं भयंकर पगलुं क्यारेय न उठावे. प्रायश्चित एक भावथी प्रेरित छे. तेना कारणे के आधार परिवर्तित थर्द जवा छतां संवेदनशीलतानो भाव बदलातो नथी, आ कारणे ज वर्तमान युगमां पश्च व्यवहारमां सम्भवामां पोते करेलां दुष्कर्मो पर हुःभ व्यक्त करवुं, क्षमा-याचना करवी, ‘अरे मने हुःभ छे’ ‘मने माझ करो’ सोरी वगोरे नित्य बोलातां के सांभूत्वा मणतां वाक्यो प्रायश्चितनां ज अंकुर छे. आजे पश्च पोतानाथी कोई अज्ञानां कोईने अन्याय के अनुचित कर्म थर्द जवाथी अनेक व्यक्तिओ उपवास करीने आत्मशुद्धि करे छे. जैन लोको तो विशेषपश्च जप-तप-ऐकासाणा-आंबेल आदिनो आश्रय ले छे. ‘लघुअर्हन्नीति’मां पश्च आ उपायोनो उल्लेख विशेष जोवा भणे छे. आत्मशोधननो उपाय छे प्रायश्चित. आधुनिक समयमां सामाजिक दबावाने अभावे मात्र आंतरिक प्रेरणानो प्रभाव अधिक छे. अपराधनो स्वीकार करवो ते पश्च एक प्रायश्चित ज कही शकाय.

पादटीप

- संस्कृत - हिन्दी कोश : गामन शिवराम आटे (पृ.६११)
- ‘प्रायो नाम तपः प्रोक्तं चित्त निश्चय उच्यते ।

- तपो निश्चयसंयोगात् प्रायश्चित्तमितीर्थे ॥' हेमाद्रि - संस्कृत- हिन्दी कोश
3. तैतिरीय संहिता : २/३/२/४, २/३/४/१, ३/३/३/२-३, ५/३/६/३ तथा ५/३/१२/१
 4. आश्वलायन श्रौतसूत्र : ३/१०
 5. शांखायन श्रौतसूत्र : ३/१६/१
 6. पारस्कर गृहसूत्र : १/१०
 7. धर्मशास्त्र का इतिहास : पी.वी. काणे, भाग-३, पृ. ३०४४
 8. शतपथ ब्राह्मण तथा ऐतरेय ब्राह्मण : ३२/३-३१
 9. याज्ञवल्क्य स्मृति : ३/२२०
 10. गौतम स्मृति : २०/२-६, मनुस्मृति : ११/१
 11. मनुस्मृति: ११/१४६, याज्ञवल्क्य स्मृति : ३/२५५
 12. विष्णुधर्म सूत्र : ४५/१, मनुस्मृति : १२/५४, याज्ञवल्क्य स्मृति : ३/२०६, ३/२२१
 13. मनुस्मृति : ११/४७
 14. मनुस्मृति : ११/८९
 15. याज्ञवल्क्य स्मृति : ३/२९८,
 16. शातातप स्मृति : १/२
 17. मनुस्मृति : ११/७२
 18. मनुस्मृति : ११/५४, याज्ञवल्क्य स्मृति : ३/२२७
 19. गौतमधर्म सूत्र : ३/४/१-१०
 20. याज्ञवलक्य स्मृति -३/२६३-२६४ वसिष्ठ स्मृति : २१/१८ मनुस्मृति : ११/१०८, ११६, पराशर स्मृति : ३१/४१, धर्मशास्त्र का इतिहास-पी.वी. काणे, हिन्दी अनुवाद तृतीय भाग : पृ - १०६८-१०७१
 21. अनभिरव्यात दोषस्तु रहस्यं व्रतमाचरेत् । याज्ञवलक्यस्मृति : ३/३००
 22. मनुस्मृति: ११/१४६, याज्ञपल्क्य स्मृति : ३/२५५

सन्दर्भ गन्थ

1. संस्कृत हिन्दी कोश : सं. वामन शिवराम आप्टे प्रकाशक : मोतीलाल बनारसीदास जवाहरनगर, बंगला रोड, दिल्ली, १९८४
2. 'हेमाद्रि' संस्कृत - हिन्दी कोश
3. तैतिरीय संहिता : संपादक : सातवलेकर, स्वाध्याय मण्डलल पारडी, वलसाड, १९५७ इ
4. कौषितकि ब्राह्मण : आनन्दाश्रम, पूना -१९९९
5. अथर्ववेद : (भाषा भाष्य सहित) दयानन्द संस्थान, नई दिल्ली संवत -२०३१
6. वाजसनेयीसंहिता : तत्त्वविवेचक प्रेस, बम्बई
7. आश्वलायन श्रौतसूत्र- आनन्दाश्रम, पूना
8. शांखायन श्रौतसूत्र- ऐशियाटिक सोसायटी, कलकत्ता
9. पारस्कर गृहसूत्र: डा. कमलेशचन्द्र पाण्डेय (हरदत्त टीका) चौम्बम्बा संस्कृत सीरीज, वाराणसी
10. धर्मशास्त्र का इतिहास : डा. पी.वी.काणे, उत्तरप्रदेश हिन्दी (भाग-३) संस्थान, लखनऊँ प्रथम संस्करण, हिन्दी अनुवाद १९७३

11. शतपथ ब्राह्मण (दोभाग) : सम्पादक : पण्डित चन्द्रधर शर्मा, बंसीधर शास्त्री, अच्युत ग्रंथमाला कार्यालय, काशी सं. ३९४४, ३९४७
12. ऐतरेय ब्राह्मण : सायणभाष्य त्रावणकोर विश्वविद्यालय संस्कृत सीरीज, त्रिवेन्द्रम्
13. वसिष्ठ स्मृति : रोयल एशियाटिक सोसायटी, आँवबंगाल कोलकाता
14. याज्ञवल्क्य स्मृति : (मिताक्षरासहित) हिन्दी व्याख्या व्याख्याकार : उमेशचन्द्रपाण्डेय, चौखम्बा संस्कृत सीरीज वाराणसी -३९६७
15. मनुस्मृति चौरबम्बा संस्कृत प्रतिष्ठान, दिल्ली, १९८५
16. अग्निपुराणम् : राजेन्द्रलाल मित्र, कलकत्ता ।
17. गरुडपुराणम् : वैंकटेश्वर प्रेस, बम्बई ।
18. कूर्मपुराणम् : वैंकटेश्वर प्रेस, बम्बई
19. वराहपुराणम् : महरचन्द लच्छमनदास, दिल्ली, १९८४
20. ब्रह्मपुराणम् : हिन्दी साहित्य संमेलन, प्रयाग
21. विष्णुधर्मसूत्र : डॉ. जूलियस जोली, चौखम्बा संस्कृत सीरीज, वाराणसी ।
22. बौद्धायन धर्मसूत्र : महर्षि बौद्धायन रचित, (गोविन्द स्वामी रचित विवरणवृत्ति सहित) डॉ. नरेन्द्रकुमार आचार्य विधानिधि प्रकाशन, दिल्ली, प्रथम संस्करण
23. यजुर्वेद : महर्षिदयानन्द भाष्य, परोपकारिणी सभा, अजमेर.
24. शातातप स्मृति :
25. गौतमधर्मसूत्र : महर्षि गौतम रचित (हरदत्त कृत मिताक्षरावृत्ति सहित (हिन्दी अनुवाद) व्याख्याता डॉ. नरेन्द्रकुमार विधानिधि प्रकाशन, दिल्ली, प्रथम संस्करण्
26. अर्थशास्त्रम् (१-३ भाग): (कौटिलीय अर्थशास्त्र) अनुवादक : ज.पु. ज्ञेष्ठीपुरा संपादक : गौतम पटेल, प्रकाशक : संस्कृत सा. अकादमी, गांधीनगर, आवृत्ति-प्रथम